

બિન સરકારી માધ્યમિક શાળાઓના  
કર્મચારીઓને લાગુ પડેલ પેન્શન યોજના  
એની સ્પષ્ટતાઓ બાબત...

ગુજરાત સરકાર,  
શિક્ષણ વિભાગ  
પરિપત્ર ક્રમાંક. મશ-૧૧૮૯-૨૯૨-૭, સચિવાલય, ગાંધીનગર.  
તારીખ. ૨૫-૪-૯૧.

વંચાણમાં લીધા :-

- ૧: શિક્ષણ અને મજૂર વિભાગનો તા.૨૧-૧૨-૭૧ના ઠરાવ ક્રમાંક.એસએસએન-૫૦૭૫-૩૧૯૭૩-ગ.
- ૨: શિક્ષણ વિભાગનો તા.૨૩-૧૨-૮૭ નો ઠરાવ ક્રમાંક.બમશ-૧૧૮૩-૯૭૬ (૮૬) છ
- ૩: ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રી ગાંધીનગરના તા.૨૭-૧૦-૮૮ના પત્રાંક:ખ-૨ /નજ/એમવી-૮૮-૨૪૮૦૦.

-: પ રિ પ ત્ર :-

બિન સરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓને પેન્શન યોજના  
૧-૪-૬૯ થી ઉપર આમુખમાં જણાવેલ ક્રમાંક(૧) ના ઠરાવથી લાગુ પાડવામાં  
આવી છે. તેમજ શિક્ષણ ક્ષેત્રે બજાવેલ વહીવટી સેવાઓ પેન્શનના હેતુ માટે  
ગોડી આપવાના હુકમો ઉપર આમુખમાં જણાવેલ ક્રમાંક(૨) ના ઠરાવથી  
કરવામાં આવ્યા છે. સદરહુ હુકમોમાં ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રીની કચેરી,  
ગુજરાત રાજ્ય, ગાંધીનગર ઉપર આમુખ ક્રમાંક:(૩) માં જણાવેલ તેમના  
તા. ૨૭-૧૦-૮૮ ના પત્રથી એવો મુદ્દો ઉપસ્થિત કરેલ છે કે લીવ વેકે-સી માં  
તેમજ હંગામી જગા ઉપર સેવા બજાવેલ કર્મચારીઓને ઉપર આમુખમાં ક્રમાંક  
(૨) માં જણાવેલ તા. ૨૩-૧૨-૮૭ ના ઠરાવથી જોગવાઈઓનો લાભ આપી  
શકાય કે કેમ? સદરહુ મુદ્દાની જરૂરી વિચારણા બાદ નીચે મુજબની સ્પષ્ટતા  
કરવામાં આવે છે

''લીવ વેકે-સીમાં અને હંગામી જગા ઉપર બજાવેલ પૂર્ણ સમયની  
સેવાઓ, પેન્શનના હેતુ માટે ગણતરીમાં લઈ શકાશે. પરંતુ તેવી  
જગાઓ નિયમિત મહેકમ પરની અને લીવ-વેકે-સીના ગાળા બાદ  
પણ ચાલુ રહેલી હોવી જોઈએ. ''

૨/- ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રી ગુજરાત રાજ્યગાંધીનગરને ઉપર્યુક્ત સ્પષ્ટતા  
તમામ સંબંધિતોના ધ્યાન ઉપર લાવી તદ્દનુસાર આવા પડતર કેસોનો નિકાલ  
કરવા વિનંતી કરવામાં આવે છે.

૩/- આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની કાઉલ ઉપર નાણા વિભાગની  
તા.૬-૬-૯૦ અને તા.૧૮-૩-૯૧ ની નોંધથી મળેલ અનુમતિ અવગણ્યા બહાર  
પાડવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

એસ.બી.ગરાસિયા.  
સેક્શન ઓફિસરી.  
શિક્ષણ વિભાગ,